

## સામાન્ય નજર થી છુપાયેલા જોખમી રસાયણો

ઓક્ટોબર ૨૦૨૦

Devastation on the Beirut dockside



Google Street View, Apr 2017



EPA, 5 August 2020

બેઝત, લેબનોનનો બંદરનો વિસ્તાર - ૪ ઓગસ્ટ ૨૦૨૦ ના વિસ્કોટ પહેલાં અને પછી

૪ ઓગસ્ટ ૨૦૨૦ના હિવરે બેઝત, લેબનોન ના બંદરમાં એક ભયંકર વિસ્કોટ થયો જેનાથી ૧૬૦ માણસોનું મૃત્યુ થયું, ૫૦૦૦ થી વધારેને ઈજા થઈ અને લગભગ ૩૦૦,૦૦૦ લોકો બેઘર થયા\*. અત્યારે નુકસાનીનો આંકડો કે વિસ્કોટના કારણનો કોઈ અંદાજ ઉપલબ્ધ નથી. પદાર્થ એમોનીયમ નાઈટ્રોટ (એએન) એ એક સામાન્ય ખાતર છે, પણ તેને ખાણમાં વિસ્કોટ કરવા માટે પણ વપરાય છે. લગભગ ૨૭૫૦ ટન (૩૦૩૦ અમેરીકી ટન) એમોનીયમ નાઈટ્રોટ ને વેર હાઉસમાં કર્યાશી વર્ષથી વધારે સમય થી સંગ્રહ કરાયેલો હતો. સ્થાનિક અધિકારીઓને પદાર્થની હાજરી અને સંગ્રહિત સમય ની જાણકારી હતી પણ સંગ્રહ નો સરખો બંદોબસ્ત કરવા માટે અપુરતા પ્રયાસ કરવામાં આવ્યા હતાં. બેઝત ના વિસ્કોટ પછી કંટલાક બંદરોએ એમોનીયમ નાઈટ્રોટ સંગ્રહ કરવા ઉપર મર્યાદા લાદી દીધી અથવા સંગ્રહ બંધ કરી દીધો. (સંઈબ વેશીગટન પોસ્ટ ઓગસ્ટ ૨૧, ૨૦૨૦)

મોટાભાગે, રોજ ચાલતાં આપણું ધ્યાન એવી ઘણી વસ્તુ ઉપર નથી પડતું જેને આપણે ઘણો સમય થી એક જ જગ્યા એ જોતા હોય છે. પરંતુ આ એક સુધૃતતા ની ચિંતા કરતાં કંઈક વિરોધ છે. રસાયણોની યોગ્ય સંગ્રહ પદ્ધતિ ખુબ જરૂરી છે ખાસ કરીને જ્યારે તે તીવ્રે થઈ શકતુ હોય.

તમારાં વિસ્તારમાં રસાયણોના એવા ડ્રમ અથવા બીજા કંટેનરનો છે જે વારંવાર વપરાતાં નથી? તમે કયારેય તેના લેબલ તરફ જોયું છો?

(\*આ બિકન તૈયાર કરાય રહ્યું હતું તે સમયનાના આંકડા)

## શું તમે જાણો છો ?

- કંટલાક રસાયણોની સેલ્ફ લાઈફ હોય છે અને તે તીવ્રે થઈ શકે છે જ્યારે તેને ખુબ લાંબો સમય અથવા અયોગ્ય પરિસ્થિતિ માં સંગ્રહ કરવામાં આવે. બેજ, હવા અથવા બીજા પદાર્થોની તીવ્રેશન તરફ દોરી જાય છે.
- તીવ્રેશન કરી શકે છે :
  - રસાયણોના સાર્વધ્યમાં ઘટાડો, જેથી તેની અસરકારતા ઓછી થઈ જાય છે.
  - સ્ટેબીલાઈઝર્સ અથવા ઇનાફીબીટર્સ માં રહેલાં એડીટીવ્સ ને અસર, જે જોખમી રસાયણોને સુરક્ષિત રાખે છે.
  - ઉગ્ર, સંભવિત વિનાશક વિઘ્નન તરફ દોરી જાય છે. (સંઈબ પીએસ બીકન જાન્યુઆરી ૨૦૦૬)
   
<https://www.aiche.org/ccps/resources/process-safety-beacon/archives/2006/january/english>
- સેફ્ટી ડાટા શીટ્સ (એસ ડી એસ) સામાન્ય રીતે યોગ્ય સંભાળ અને નિકાલ માટે યોગ્ય સંગ્રહ સ્થિતિ અને માર્ગદર્શન પુરું પાડે છે.
- રસાયણો જેની વિસ્તારમાં જરૂર નથી તે સંભવિત ચુવાક અને ફેલાવા માટેના ઉદ્ગમસ્થાન બની શકે છે.
- વિસ્તારમાં જરૂરીયાત કરતાં વધારે રસાયણો હોય તો ચુવાક અથવા ફેલાવા વખતે તે અસર વધારી શકે છે.

## તમે શું કરી શકો ?

- તમારા વિસ્તારમાં લાંબા સમયથી સંગ્રહિત ડ્રમ અને કંટેનર્સ ને શોધો. તેની વાપરવા માટેની અંતિમ તારીખ ને ચકાસો અને સંગ્રહ માટેની યોગ્ય સ્થિતિની ખાતી કરો.
- જો તમને અંતિમ તારીખ પછીના કંટેનર મળે તો તમારાં સુપરવાઈઝરને તુરંત જાણ કરો. જુના કંટેનરને ખોલવા પ્રયત્ન ન કરો અથવા તેને હલાવવા પણ નહીં – અંદરનો પદાર્થ કદાચ અસ્થિર થઈ ગયો હોય અથવા કંટેનર કદાચ કટાઈ ગયું હોય.
- અને જો કંટેનર તેની અંતિમ તારીખ પહેલાં નું પણ હોય તો પુછો કે આ અંહી કેમ છે. કદાચ તે બાકી રહી રહ્યું હોય અને પછી ભુલાય રહ્યું હોય. તેને યોગ્ય સંગ્રહ સ્થાને પહોંચાડવાની જરૂર છે.
- જ્યારે રસાયણો ને વાપરો ત્યારે તેની ઉત્પાદન કરેલી તારીખ ને જુઓ અને જે રસાયણ જુનું હોય તેને પહેલાં વાપરો – જો તેની વાપરવાની અવધિ સમાપ્ત ન થઈ ગઈ હોય તો.

**તમારાં વિસ્તારમાં લાંબા સમયથી સંગ્રહ કરેલાં પદાર્થો તરફ નજર કરો.**